

Kovidavyapanakale Loke

——
कोविडव्यापनकाले लोके

——
Document Information



Text title : koviDavyApanakAle loke

File name : koviDavyApanakAleloke.itx

Category : misc, sanskritgeet

Location : doc_z_misc_general

Author : muthalapuraM mohanadAsa

Description/comments : Sanskrit through Songs Series Song 2

Acknowledge-Permission: Muthalapuram Mohanadasa muthalapurammohandas@gmail.com

Latest update : August 11, 2024

Send corrections to : sanskrit at cheerful dot c om

This text is prepared by volunteers and is to be used for personal study and research. The file is not to be copied or reposted without permission, for promotion of any website or individuals or for commercial purpose.

Please help to maintain respect for volunteer spirit.

Please note that proofreading is done using Devanagari version and other language/scripts are generated using **sanscript**.

August 12, 2024

sanskritdocuments.org



Kovidavyapanakale Loke

કોવિડવ્યાપનકાલે લોકે



કોવિડવ્યાપનકાલે લોકે

માનવાસ્સર્વે સંભીતા જાતાઃ ।

ઉચ્ચો વા નીચો વા મધ્યમો વા

નાસ્તિ વિભેદઃ કોરોણાયાશ્ચ ॥

While Covid is rampant in the country,
mankind is all terrified. Corona does
not discriminate the lower, middle,
and upper classes.

મન્ત્રી વા તન્ત્રી મહાજનો વા

મન્ત્રચત્યેકં કોરોણામન્ત્રમ્ ।

મન્ત્રેણ ચન્ત્રેણ નૈવ વાર્યા

જાગ્રતા એકાસ્તિ તન્નિરોધે ॥

Minister, priest or common man, all are
chanting but only the Corona Mantra.

It can be encountered with neither
chanting or charm, the only prevention
possible is being Alert.

સચ્છીલાનાં પરિપાલનેન

ઉચ્ચાટનં સાધ્યં કોવિડસ્ય ।

યત્ર કુત્રાપિ વા સચ્ચરણે

વ્યક્તિશુચિત્વં પ્રધાનમેવ ॥

Covid can be warded off only through
observing chaste routines.

Wherever one goes, personal hygiene
is important.

कार्यालये वांयसङ्गमे वा
 धार्यं सदापि मुभावरणम् ।
 उस्तप्रक्षालनं मध्ये मध्ये
 कर्तव्यमेवाणुनाशनाय ॥

Whether one is in an office of there
 in a meeting place, wearing mask is a
 must. Virus eliminarian is possible
 only be washing hands at refgular
 intervals.

सामूढिकानन्तरं कल्पनीयम्
 शारीरिकं नतु मानसिकम् ।
 उस्तदानं मास्तु स्वीकरणे
 वक्तुमुचितं “नमस्ते” अवे ॥

Social distancing is essential physically,
 not mentally. Greetings should not be
 through handshake, a verbal greeting like
 ‘Namaste’ should be preferred.

आषर्यं कोविडवैभवेन
 निश्चलं सर्वं पिनद्धं जातम् ।
 नास्ति गत्यन्तरमित्यतो ङि
 सर्वे जना गृहमाश्रयन्ति ॥

It is amazing that, by the glory of Covid,
 everything has become still and locked.
 Now, as there is no other go, people is
 finding solace at home alone.

पितरस्सन्तुष्यन्ति स्वात्मजानां
 सततस्सानिधेन दुर्लभेन ।
 अवेमपत्यान्यनुभवन्ति
 वात्सल्यमन्यथा नैव लभ्यम् ॥

Men are gladdening parents and children,

by constant presence, which used to be rare.

नास्ति बहिर्मुधा पर्यटनं
अस्ति दुराशानां संयमनम् ।
भूत्वा गृहे सर्वे सन्निहिताः
स्वस्थाः परस्परं संवदन्ति ॥

Unwanted outings have stopped and hence
all are ever available in the house.
The family members have healthy
communication among them.

कोविड्गुरोरनुशासनेन
कोविदा जाताः मलाजनाश्च ।
अन्यविश्वासदुरायाराणं
अन्तमभवदनेककानाम् ॥

By order from Guru Covid, people became
more aware of life and have got rid of
many superstitions and amorality.

अस्ति जगदीश सर्वतोऽपि
ःश्वरतुल्यजनोऽस्ति लोके ।
मानवसेवा भवति साक्षात्
दैविकसेवा वदति कोविड् ॥

God is omnipresent. There are godlike
men too in this world. Serving mankind
is the same as serving God: says Covid.

यानानि सर्वाणि निश्चलानि
राजमार्गाः जाता निर्जनाश्च ।
अन्तस्थितेषु जनेषु बाह्ये
सर्वतो वन्यमृगाश्चरन्ति ॥

As vehicles stopped plying roads,
streets have become tidier and secluded,
wild-life is free to move around.

माणिन्यमुक्ता जवाशयाः!
 स्वय्यञ्च सञ्जातमन्तरीक्षं ।
 जन्तवो विस्मिता मानवानां
 मानसान्तरं कथं नु जातम् ? ॥

Water sources are cleaner. The
 atmosphere has become pollution free.
 The animals may be wondering what made
 the human change their mind?

अस्ति कृषिकर्म गेहे गेहे
 अस्ति सुभिक्षं दिने दिने च ।
 नास्ति पिधानवैरस्यमत्वं
 वेत्ति जनोऽपि कुटुम्बसौख्यम् ॥

Every homestead has farming these days
 and there is lot to eat. Instead of the
 lockdown, more people are experiencing
 family bliss.

कोविड्! त्वं गुरुर्मानवानां
 पाटुःआननेकान् त्वं पाठितवान् ।
 पाठनेमत्यन्तमुत्तमं स्यात्
 कोऽपि न विस्मरेज्जिवनान्तम् ॥

Covid, you are Guru to mankind.
 You have taught many lessons.
 Your teaching methodology is excellent!
 No one will forget these learning
 experiences.

अेवं स्थितेऽपि त्वां कीर्तयितुं
 साध्यं कथं तव दृश्वरितैः ? ।
 मृत्युं वपसि त्वं मर्त्यलोके
 भृत्यो वा त्वं भुवनान्तकस्य ? ॥

However, it is not proper to heap praises
 on you. You are spreading death on earth.

Are you an agent of the God of destruction?

उत्सर! कोविड! रे दुरात्मन्!
भर्सयति त्वां जगद्विदानीम् ।
वाक्सिनागच्छेत्त्वन्नाशनाय
उज्जित्वा गच्छ! सुवनाच्छीघ्रम् ॥

Clear out! Evil minded Covid, demands the
world. It is sure that vaccine will
arrive to destroy you. Go, leave the
world at the earliest.

कोविडनिर्माज्जनाय लोकाः!
अद्भुतपरिकरा सन्त्विदानीम्! ।
त्यज्यन्थां भेदविवेचनानि
लोकाः समस्तास्सुप्सुप्सन्तु! ॥

O men of the world, set aside the radical
discriminations and get set to drive
away the Covid menace, so that there
shall be welfare for the entire world.

धन्यवादाः मास्तु पुनरागमनम् !
- मुतलपुरं मोहनदास

Composed by Muthalapuram Mohandas

Kovidavyapanakale Loke

pdf was typeset on August 12, 2024

Please send corrections to sanskrit@cheerful.com

